

રચના

☐ એકમાત્ર માલિક ☐ એચયુએફ ☐ ભાગીદારી પેઢી ☐ એલએલપી ☐ ખાનગી/જાહેર ટ્રસ્ટ ☐ રજિસ્ટર્ડ સોસાયટી ☐ કલબ ☐ સરકારી/અર્ધ સરકારી સંસ્થા
☐ જાહેર લિમિટેડ કંપની ☐ ખાનગી લિમિટેડ કંપની ☐ વ્યક્તિઓનું સંગઠન ☐ વ્યક્તિગત સંસ્થા ☐ ટ્રસ્ટ ☐ અન્ય, સ્પષ્ટતા આપો
 ગણું તે બિન-લાભકારી સંસ્થા છે: ☐ હા ☐ ના
 જો હા, તો દર્પણ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરો (દર્પણનો અનન્ય આઈડી નં. દર્શાવવો)

સંચાલનનો પ્રકાર

☐ સ્વયં/માલિક ☐ ભાગીદારો/ ડિરેક્ટર્સમાંથી ગમે તે એક ☐ એચયુએફના કર્તા ☐ પીઓએ હેઠળ/ મેનેજર ☐ બધા સંયુક્ત રીતે ☐ અન્ય કોઈ હોય તો જણાવો

ખાતું ખોલાવવા માટેની ચૂકવણીની વિગતો

☐ રૂા. _____ રકમ રોકડા શબ્દોમાં _____
☐ ટ્રાન્સફર
 ડેબિટ ચાલુ / બચત ખાતા નં. ચેક નં. રૂા. _____
 રકમ રોકડા શબ્દોમાં _____ તારીખ
 બેંકનું નામ _____ શાખા _____

મુદતી થાપણ માટે પાકતી મુદતની સૂચનાઓ

ઓટો રિન્યુઅલ

રિન્યુઅલની સંખ્યા: _____ (વધુમાં વધુ ૯૯ વખત)
☐ મુદ્દલ અને વ્યાજ
☐ રિન્યુઅલ રૂા. _____ ના વધારા/ઘટાડા સાથે _____ શાખા ખાતેના મારા/અમારા ખાતા નં. માંથી/માં સાથે કરવું
☐ રિન્યુ પ્રોડક્ટ સ્વીચ ટુ: ☐ સીએફ ☐ એસટીડી ☐ એફડીઆર-એમ ☐ એફડીઆર-ક્યુ ☐ એફડીઆર-એચ ☐ એફડીઆર-વાય _____ અન્ય, _____ દર્શાવવાની સાથે _____ મહિના _____ દિવસ માટે કરવું
☐ ફક્ત મુદ્દલ અને વ્યાજ જમા કરવાનું છે તેની વિગત
 ખાતા નં.: આઈએફએસસી કોડ:
 બેંકનું નામ: _____ શાખાનું નામ: _____

બંધ:

☐ મુદ્દલ અને વ્યાજ જમા કરવાનું છે તેની વિગત
 ખાતા નં.: આઈએફએસસી કોડ:
 બેંકનું નામ: _____ શાખાનું નામ: _____

ઉપરના પસંદ કરેલ ઓટો રિન્યુઅલની સંખ્યાની પૂર્ણતા પર મુદતી થાપણ બંધ થઈ જશે અને તે સમયની વધેલી રકમ ઉપર દર્શાવેલ “પાકતી મુદતની સૂચના”માં દર્શાવવામાં આવેલા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે.

ચૂકવણી માટે ખાતાધારકની ખાસ સૂચના

ફૂપા કરીને માસિક/ત્રિમાસિક/છ માસિક/ વાર્ષિક અંતરાલ પર સૂચવેલ પ્રણાલીથી વ્યાજની ચૂકવણી કરવી -
☐ એસબી/સીડી/સીસી/ઓડી ખાતા નં. માં _____ શાખા ખાતે જમા કરવામાં આવ્યા
☐ પે ઓર્ડર
☐ એનઈએફટીના માધ્યમથી
 લાભાર્થીનો ખાતા નં. બેંકનું નામ: _____ શાખાનું નામ: _____
 આઈએફએસસી કોડ:
☐ ફૂપા કરીને મારા/ અમારા _____ શાખાના એસબી/સીડી/ સીસી/ઓડી ખાતા નં.
 માંથી રૂા. _____ માસિક આરડી હસાની રકમ ઉધારશો.

જરૂરી સુવિધાઓ

☐ ચેક બુક ☐ ઇન્ટરનેટ બેન્કિંગ ☐ મોબાઇલ બેન્કિંગ ☐ એસએમએસ ☐ ઇ-સ્ટેટમેન્ટ: ☐ દૈનિક ☐ માસિક ☐ લોકર ☐ ડીમેટ ☐ ક્યુઆર કોડ
☐ ડેબિટ કાર્ડ: ☐ રેગ્યુલર ☐ પ્રિપેઇડ
 (દરેક જરૂરી સુવિધાઓ માટેની પસંદગી માટે અલાયદા અરજી ફોર્મ ભરવાના રહેશે)
 હાલના કાર્ડ નંબરની સાથે લિંક
 SMS એવર્ટસ માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર:
 ઇમેઇલ એવર્ટસ માટે રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી

સંપર્કની વિગતો

એસએમએસ રજિસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર*: વૈકલ્પિક મોબાઇલ / ટેલિફોન નં.
 ઇમેઇલ આઈડી*:
 વેબસાઇટ

રજિસ્ટર્ડ સરનામું/ કાયમી સરનામું*

એડ્રેસ લાઇન ૧	
એડ્રેસ લાઇન ૨	
એડ્રેસ લાઇન ૩	
ગામ	તાલુકો જિલ્લો શહેર
રાજ્ય	પીન કોડ પોસ્ટ ઓફિસ

પત્રવ્યવહાર માટે/ હાલનું સરનામું* ■ રજિસ્ટર્ડ સરનામું છે તે જ અથવા

એડ્રેસ લાઇન ૧	
એડ્રેસ લાઇન ૨	
એડ્રેસ લાઇન ૩	
ગામ	તાલુકો જિલ્લો શહેર
રાજ્ય	પીન કોડ પોસ્ટ ઓફિસ

પત્રવ્યવહાર માટે/ હાલનું સરનામું* ■ વ્યવસાયનું મુખ્ય મથક ■ રજિસ્ટર્ડ સરનામું છે તે જ અથવા

એડ્રેસ લાઇન ૧	
એડ્રેસ લાઇન ૨	
એડ્રેસ લાઇન ૩	
ગામ	તાલુકો જિલ્લો શહેર
રાજ્ય	પીન કોડ પોસ્ટ ઓફિસ

રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની યાદી*

રજૂ કરાયેલા દસ્તાવેજોની યાદી	ને લાગુ પડે છે	દસ્તાવેજ સંદર્ભ નં.	લાગુ પડતું હોય ત્યાં ટીક કરો		જારી કર્યા તારીખ (લાગુ પડતું હોય ત્યાં)	સમાપ્તિની તારીખ (લાગુ પડતું હોય ત્યાં)
			ઓળખનો પુરાવો	સરનામાનો પુરાવો	તારીખ-મહિનો-વર્ષ	તારીખ-મહિનો-વર્ષ
પીએએન	તમામ					
ફોર્મ ૬૦	કંપની અને એલએલપી સિવાયના લોકો					
એમએસએમઈ પ્રમાણપત્ર	તમામ					
ઉદ્યમ આધાર	કંપની					
નિગમનનું પ્રમાણપત્ર	કંપની					
આરેભ કરાયાનું પ્રમાણપત્ર	કંપની					
પેટા કાયદા	સોસાયટી/ટ્રસ્ટ					
રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર	કંપની/સોસાયટી/ટ્રસ્ટ/એલએલપી/ઓપીસી					
રજિસ્ટર કરાયેલો ભાગીદારી કરાર	ભાગીદારી					
મેમોરેન્ડમ/ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન	કંપની/એલએલપી					
ટ્રસ્ટનો સમજૂતી કરાર	ટ્રસ્ટ					
એચયુએફનું એકરારનામું	એચયુએફ					
હુકાન અને કાર્યસ્થળનું લાઇસન્સ	તમામ					
જીએસટી પ્રમાણપત્ર	તમામ					
સુવિધા વપરાશનું બિલ	તમામ					
આઈટીઆર	તમામ					
ખાતું ખોલાવવા માટેનો ઠરાવ/ અરજી અને સંચાલનની પ્રણાલી	તમામ					
તેના મેનેજર/અધિકારી અથવા કર્મચારીઓને તેના વતી વ્યવહાર કરવા માટે આપવામાં આવેલ પાવર ઓફ એટર્ની	તમામ					
ડિરેક્ટર્સ/ અધિકૃત સહી કરનાર વ્યક્તિઓ અને તેમના સરનામાં/ ફોર્મ ૩૨	પ્રા. વિ. કંપની/ જાહેર વિ. કંપની					
ભાગીદારોની યાદી	ભાગીદારી					
ટ્રસ્ટ/ સંરક્ષકોના ટ્રસ્ટીઓ/ સમાધાનકારો/ લાભાર્થીઓની યાદી	ટ્રસ્ટ					
અન્ય:						
૧.						
૨.						
૩.						

મે.

કસ્ટમર આઈડી

શાખામાં સીડી/સીસી/ઓડી ખાતા નં. શાખા _____

ટેલિ. નં. / મોબાઇલ નં.

શહેરું શ્રી/શ્રીમતી _____ ને આટલા સમયથી જાણું છું મહિના/વર્ષો અને તેના સરનામાની પુષ્ટિ કરો.

તારીખ:

સ્થળ: _____

પરિચય આપનારની સહી અને સિક્કો

હું/અમે અત્રે જાહેર કરીએ છીએક કે ઉપર તૈયાર કરવામાં આવેલ માહિતી અને એકરારનામું/નામાં મારી/અમારી જાણકારી પ્રમાણે યોગ્ય અને સાચા છે.

તારીખ:

સ્થળ: _____

અધિકૃત સહી કરનાર વ્યક્તિઓની સહી અને સિક્કો

દસ્તાવેજી પ્રાપ્ત કરવામાં આવ્યાં ☐ સ્વ-પ્રમાણિત ☐ ખરી નકલો ☐ નોટરી
☐ કર્મચારી ☐ બીસી દ્વારા વ્યક્તિગત રીતે ચકાસણી કરવામાં આવી
 ઓળખની ચકાસણી ☐ કરવામાં આવી તારીખ

D	D	M	M
---	---	---	---

 -

Y	Y	Y	Y
---	---	---	---

કોડ આઈએન

--	--	--	--	--	--	--	--	--	--

કર્મચારી/બીસીનો કોડ

--	--	--	--	--	--	--	--	--	--

કર્મચારીનો હોદ્દો

--	--	--	--	--	--	--	--	--	--

કર્મચારી/બીસીની શાખા

--	--	--	--	--	--	--	--	--	--

[કર્મચારી/બીસીની સહી]

જોખમની કેટેગરી: ☐ ઊંચી ☐ મધ્યમ ☐ નીચી
☐ સીડીડી મેળવ્યું ☐ ઇડીડી મેળવ્યું (લાગુ પડે છે તે મુજબ)

સંસ્થાની વિગતો
 નામ ટીજેએસબી સહકારી બેંક લિ.
 કોડ આઈએન IN0860

બેંકનો
સિક્કો

મેનેજરની સહી

	કર્મચારીનો કોડ	કર્મચારીનું નામ	કર્મચારીની સહી
દ્વારા ઝીણવટભરી ચકાસણી કરાઈ			
દ્વારા એન્ટર કરવામાં આવ્યું			
દ્વારા અધિકૃત કરવામાં આવ્યું			

નિયમો અને શરતો/ એકરારનામા/ સંમતિ

એકરારનામું:

૧. હું/ અમે બહાવી આપીએ છીએ કે હું/ અમે ભારતના નાગરિક/કો છીએ.
૨. મેં/અમે બેંકની વેબસાઇટ (www.tjsb.bank.in) પર દર્શાવવામાં આવેલા નિયમો અને શરતોનું વાંચન કર્યું છે અને સમજ્યા છીએ, જે ટીજેએસબી સહકારી બેંક લિમિટેડમાં ખાતું ખોલાવવા અને એટીએમ/રૂપે ડેબિટ કાર્ડ/નેટ બેન્કિંગ સહિતની પરંતુ ત્યાં સુધી સીમિત નહીં તેવી વિવિધ સેવાઓના ઉપયોગને લગતી છે.
૩. હું/અમે જાહેર કરી અને જણાવીએ છીએ કે હું/અમે બેંક દ્વારા ડેબિટ કાર્ડને લગતા નિર્ધારિત ધોરણોનો અમલ કરીશું.
૪. હું/અમે આથી જાહેર કરીએ છીએ કે હું/અમે સ્વેચ્છાએ સ્વીકારી રહ્યા છીએ અને/અથવા આધાર અધિનિયમની કલમ ૭ હેઠળ આવરી લેવામાં આવતી સબસિડી, લાભો/સેવાઓ મેળવવા માટે, મારા/અમારા ખાતામાં કોઈપણ નાણાકીય સબસિડી અથવા લાભ ટ્રાન્સફર કરવા તેમજ આધાર આધારિત માઇક્રો- એટીએમ મશીન, એઈપીએસ, ભીમ આધાર પે વગેરે દ્વારા મારા/અમારા દ્વારા પૈસા ઉપાડવાની સુવિધા આપવા માટે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા પૂરી પાડવામાં આવતી આધાર પ્રમાણીકરણ પ્રક્રિયામાંથી પસાર થવા ઇચ્છીએ છીએ. હું/અમે જાહેર કરીએ છીએ કે હું/અમે ટીજેએસબી સહકારી બેંક લિ. શાખામાં મારું/અમારું ખાતું ખોલાવવા અને/અથવા ટીજેએસબી સહકારી બેંક લિ.ની શાખામાં રહેલા મારા/અમારા પ્રવર્તમાન ખાતા નંબર સંદર્ભે કેવાયસી/ ઇ-કેવાયસીના અપડેશન માટે આધાર કાર્ડની નકલ સ્વૈચ્છિક રીતે પૂરી પાડી રહ્યો/રહ્યા છું/છીએ. અત્રે યુઆઈડીએઆઈ / ટીજેએસબી સહકારી બેંક લિ.ને મારો ઇ-કેવાયસી ડેટા શેરિંગ કરવાનો મને/અમને કોઈ વાંધો નથી. મારી/ અમારી કેવાયસી ઔપચારિકતાઓ માટે ટીજેએસબી સહકારી બેંક લિ. દ્વારા સૂચવવામાં આવેલ યુઆઈડીએઆઈ અથવા આધાર કાર્ડની નકલની વિગતો અંગે બાયોમેટ્રિક સ્કેન અથવા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પૂરો પાડવા હું સંમત છું.
૫. હું/અમે ખાતાધારક/ખાતાઓની સ્થિતિમાં કોઈપણ ફેરફાર અથવા ખાતાધારકો વચ્ચે અથવા ઉપરોક્ત ખાતાઓના સંદર્ભમાં ઉદભવતા વિવાદો વિશે બેંકને જાણ કરવાની બાંહેધરી આપીએ છીએ અને તે અંતર્ગત મારા/અમારા દ્વારા કોઈપણ ફેરફારો/વિવાદો વિશે બેંકને જાણ કરવામાં નિષ્ફળતાને કારણે બેંકને થયેલા કોઈપણ નુકસાન અથવા નુકસાન સામે બેંક અને તેના અધિકારીઓને વળતર આપવા બંધાયેલા છીએ.
૬. મારા/અમારા દ્વારા આ ફોર્મમાં પૂરી પાડવામાં આવેલી માહિતી ધ ઇન્ડમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ને ધ ઇન્ડમ ટેક્સ ઇલ્સ, ૧૯૬૨ના નિયમ ૧૧૪એફ થી ૧૧૪એયની સાથે વાંચનમાં લેવામાં આવે, તેના અનુસાર છે. મારી/અમારી જવાબદારી રહેશે કે હું મારી જાતને શિક્ષિત કરું અને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૨૮૫બીએ અને તેના હેઠળના નિયમો હેઠળ રિપોર્ટિંગ સંબંધિત તમામ સંદર્ભિત કાયદાઓનું હંમેશાં પાલન કરું.
૭. હું/અમે સંમત છીએ કે મેં/અમે મારા/અમારા રજિસ્ટર કરેલા ડિજિટલ બેન્કિંગના ખાતામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના ઉપયોગથી રજિસ્ટર કરેલા કોઈપણ થર્ડ-પાર્ટી બેનિફિશીયરી/ઓના ખાતા/ઓમાં ટ્રાન્સફર કરેલા ભંડોળની સંપૂર્ણ જવાબદારી મારી/અમારી રહેશે.
૮. હું/અમે ખોટી/અપૂર્ણ માહિતી પૂરી પાડવાને કારણે અને મોબાઇલ બેન્કિંગના દુરુપયોગ વગેરેના કારણે બેંકને થયેલા તમામ અને/અથવા કોઈપણ નુકસાન, ખર્ચ વગેરે માટે બેંકને નુકસાન ભરપાઈ કરવા સંમત છીએ.
૯. હું/અમે કોઈપણ અનધિકૃત ઉપયોગ ટાળવા માટે મારા/અમારા ખાતાની વિગતોને સુરક્ષિત રાખવા માટે તમામ સાવચેતી રાખીશું. ટીજેએસબી સહકારી બેંક લિમિટેડ મારા/અમારા લોગઇન આઈડી, પાસવર્ડ, કાર્ડ નંબર અથવા પિન (વ્યક્તિગત ઓળખ નંબર) કોઈને પણ શેર કરવાથી/જાહેર કરવાથી થતા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં, અને કોઈપણ અનધિકૃત ઉપયોગ માટે બેંક પર દાવો કરીશું નહીં.
૧૦. હું/અમે આ સાથે સંમત છીએ કે બેંક મારા/અમારા ગ્રાહક ઓળખ નંબરને બેંક સાથેના મારા સંબંધિત દસ્તાવેજો સાથે વિલયિત કરશે, જેથી બેંક મને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફરજિયાત એક અનન્ય ગ્રાહક ઓળખ કોડ ફાળવી શકે.
૧૧. હું/અમે બેંકની જવાબદારીને અવગણવા/મર્યાદિત કરતી શરતો સહિત ઉપરોક્ત નિયમો અને શરતો સાથે બંધનકર્તા રહેવા માટે સંમત છીએ અને તેને સ્વીકારીએ છીએ.
૧૨. હું/અમે સહમત છીએ કે સમય સમય પર લાગુ પડતા સર્વિસ ચાર્જીસ બેંક મારા ખાતામાંથી ઉધારી શકે છે.
૧૩. હું/અમે સમજીએ અને સ્વીકારીએ છીએ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ એક્સચેન્જ કંટ્રોલ રેગ્યુલેશનના કડક અમલમાં કરવાનો રહેશે અને તેમાં કોઈપણ વિફળતા ઉદભવે, તેવી ઘટનામાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ૧૯૯૯ અને તેમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાગુ કરવામાં આવેલા સુધારાઓ અંતર્ગત કાર્યવાહી માટે હું/અમે જવાબદાર રહીશું.
૧૪. ચાલુ ખાતું ખોલાવવા અને તેની જાળવણી અંગેના નિયમો અને શરતો મને શાખાના અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા છે અને હું/અમે તેની સાથે બંધનકર્તા રહેવા માટે સંમત છીએ.
૧૫. હું/અમે બાંહેધરી આપીએ છીએ કે મારા/અમારા તાજેતરના રેગીન ફોટોગ્રાફ ચોટાડવામાં આવ્યા છે અને મેં/અમે પીઓઆઈ અને પીઓએના સમર્થનમાં સ્વ-પ્રમાણિત ફોટોકોપી કેવાયસી દસ્તાવેજ રજૂ કર્યા છે. આ ફોર્મમાં મારા/અમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી સાચી, યોગ્ય અને સંપૂર્ણ છે. હું/અમે સમર્થન આપીએ છીએ કે હું/અમે એફએટીસીએ/સીઆરએસના નિયમો અને શરતોથી વાકેફ છીએ અને અત્રે તેને સ્વીકારીએ છીએ.
૧૬. હું/અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ ફોર્મમાં મારા/અમારા દ્વારા ભરવામાં આવેલી માહિતી, તેના સમર્થક પરિશિષ્ટ ઉપરાંત મારા/અમારા દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો પુરાવા મારી/અમારી જાણકારી અને માન્યતામાં સાચા, યોગ્ય અને સંપૂર્ણ છે તેમજ આ ખાતાના રિપોર્ટબલ એકાઉન્ટ અથવા અન્યથા પ્રકાર તરીકે ખાતાની આકારણી/કેટેગરીને અસર પહોંચાડે તેવી કોઈ માહિતી સામગ્રી છુપી રાખી નથી.
૧૭. હું/અમે બેંકને બેંક અને તેના કોઈપણ સહયોગીઓ દ્વારા, જ્યાં પણ સ્થિત હોય ત્યાં, ખાતા અને તેમાંના તમામ વ્યવહારો સંબંધિત માહિતી એકત્રિત કરવા, સંગ્રહિત કરવા, વાતચીત કરવા અને પ્રક્રિયા કરવાની પરવાનગી/અધિકૃતતા આપીએ છીએ, જેમાં તેમની વચ્ચે અને ભારતમાં અને/અથવા બહારના અધિકારીઓને કોઈપણ ગોપનીય માહિતી શેર કરવા, ટ્રાન્સફર કરવા અને જાહેર કરવા સહિત, કોઈપણ કાયદા અથવા નિયમન, પછી ભલે તે સ્થાનિક હોય કે વિદેશી, તેનું પાલન કરવા માટે કોઈપણ ગુપ્ત માહિતીનો સમાવેશ થાય છે.
૧૮. હું/અમે એ બાબતે પણ સંમત છીએ કે મને/અમને હાલમાં અથવા ભવિષ્યમાં કોઈપણ મહત્વપૂર્ણ હકીકત જાહેર કરવામાં મારી/અમારી વિફળતા, મારી/અમારી અરજીને અમાન્ય કરી શકે છે અને બેંક મારા/અમારા ખાતાના સંચાલનમાં નિયંત્રણો મૂકવા અથવા તેને બંધ કરવા અથવા કોઈપણ નિયમનકાર અને/અથવા ભારત સરકાર (જીઓઆઈ)/આરબીઆઈ દ્વારા આ હેતુસર નિમાયેલા કોઈપણ સત્તાધિકારીને જાણ કરવાનો અથવા જો મારા/અમારા દ્વારા નિર્ધારિત સમયગાળામાં ખામી દૂર કરવામાં ન આવે તો બેંક દ્વારા યોગ્ય ગણાય તેવી કોઈપણ અન્ય કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવે છે.
૧૯. હું/અમે આથી સ્વીકારીએ છીએ અને સમર્થન આપીએ છીએ કે મેં બેંકને પૂરી પાડેલી માહિતીની પુષ્ટિ કરવા માટે જાહેર ડોમેનમાં ઉપલબ્ધ માહિતીમાંથી તપાસ કરવાનો અધિકાર અને સત્તા બેંક પાસે રહેશે.
૨૦. હું/અમે ભારતમાં કે વિદેશમાં આ સંબંધે કાયદામાં થયેલા કોઈપણ ફેરફારને કારણે બેંકને સમયાંતરે જરૂરી માહિતી અને/અથવા દસ્તાવેજો પૂરા પાડવા માટે પણ સંમત છીએ.
૨૧. હું/અમે ખોટી અથવા અધૂરી માહિતી આપવાથી બેંકને થતા કોઈપણ નુકસાન માટે બેંકને નુકસાન ભરપાઈ કરી આપીશું.
૨૨. હું/અમે ઉપરોક્ત રજિસ્ટર્ડ નંબર/ઈમેઇલ સરનામાં પર SMS/ઈમેઇલ દ્વારા સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી પાસેથી માહિતી મેળવવા માટે સંમતિ આપીએ છીએ. આથી હું/અમે બેંકને સેન્ટ્રલ કેવાયસી રેકૉર્ડ્સ રજિસ્ટ્રીમાંથી મારો/અમારો સીકેવાયસી રેકૉર્ડ ડાઉનલોડ કરવા માટે સંમતિ આપીએ છીએ.

૨૩. મને/અમને પ્રમાણીકરણ પર શેર કરી શકાય તેવી માહિતીના પ્રકાર વિશે સમજાવવામાં આવ્યું છે. મને/અમને સમજ આપવામાં આવી છે કે બેંકમાં જમા કરવામાં આવેલી મારી માહિતીનો ઉપયોગ ઉપરોક્ત હેતુ સિવાય અથવા કાયદાની જરૂરિયાતો અનુસાર અન્ય કોઈપણ હેતુ માટે કરવામાં આવશે નહીં.
૨૪. જો મારા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં મારી જન્મ તારીખ/નામ/મિડલ નેમ/થર્ડ નેમ/અટકમાં મેળ ખાતો ન હોય, તો હું, આથી, પુષ્ટિ કરું છું કે આ ફોર્મમાં ઉલ્લેખિત જન્મ તારીખ/નામ/મિડલ નેમ/થર્ડ નેમ/અટક વિ./બધું સાચું છે. હું/અમે, આ ઘોષણાપત્ર પર વિશ્વાસ રાખવા અને તેના પર કાર્યવાહી કરવા બદલ ટીજેએસબી સહકારી બેંક લિમિટેડ દ્વારા થયેલા કોઈપણ દાવા અને નુકસાન સામે ટીજેએસબી સહકારી બેંક લિમિટેડને વળતર આપવા બંધાયેલા છીએ.
૨૫. મેં ખાતું ખોલવાના ફોર્મમાં મારી હાલની સહી કરી છે. મારી પાસે હાલની સહીવાળું કોઈ દસ્તાવેજ ન હોઈ મેં બેંકના કર્મચારીની હાજરીમાં સહી કરી છે અને મારો તાજેતરનો ઓળખ પુરાવા દસ્તાવેજ - રજૂ કર્યો છે. હું મારી ઓળખની પુષ્ટિ કરું છું; મારી ઓળખના પુરાવાની એક નકલ આ સાથે બીડવામાં આવી છે. ખાતું ખોલાવવાના ફોર્મ પરની મારી સહીને મારી હાલની સહી તરીકે ધ્યાનમાં લેવા વિનંતી કરું છું.
૨૬. અત્રે હું/અમે સંમતિ આપીએ છીએ કે મારા પત્રવ્યવહારના સરનામામાં કોઈપણ ફેરફારની સ્થિતિમાં, હું/અમે તાત્કાલિક બેંકને જાણ કરીશું. જો મારા દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલ સરનામામાં ફેરફાર થાય, તો હું/અમે નોંધ લઈએ છીએ કે ખાતાના રેકૉર્ડમાં અપડેટ કરવા માટે સરનામાનો નવો પુરાવો શાખામાં રજૂ કરવો. ઉપરાંત, હું/અમે સમર્થન આપીએ છીએ કે જો સરનામાના પુરાવાની નકલ બેંકમાં સંતોષકારક રીતે રજૂ કરવામાં ન આવે, તો દ મહિનાની અંદર, બેંકને આ ખાતું ફ્રીઝ/બંધ કરવાનો અધિકાર રહેશે. હું/અમે, આ ઘોષણાપત્ર પર વિશ્વાસ રાખવા અને તેના પર કાર્ય કરવા બદલ ટીજેએસબી સહકારી બેંક લિમિટેડ દ્વારા થયેલા કોઈપણ દાવા અને નુકસાન સામે ટીજેએસબી સહકારી બેંક લિમિટેડને નુકસાન ભરપાઈ કરવા બંધાયેલા છીએ.
૨૭. મારા/અમારા દ્વારા આ ફોર્મમાં પૂરી પાડવામાં આવેલી માહિતી ધ ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ને ધ ઇન્કમ ટેક્સ રુલ્સ, ૧૯૬૨ના નિયમ ૧૧૪એફ થી ૧૧૪એચની સાથે વાંચનમાં લેવામાં આવે, તેના અનુસાર છે. મારી/અમારી જવાબદારી રહેશે કે હું મારી જાતને શિક્ષિત કરું અને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૨૮૫બીએ અને તેના હેઠળના નિયમો હેઠળ રિપોર્ટિંગ સંબંધિત તમામ સંદર્ભિત કાયદાઓનું હંમેશાં પાલન કરું.

યાલુ બેંક ખાતું — શરતો અને નિયમો:

- યાલુ બેંક ખાતાઓનો ઉપયોગ ફક્ત વ્યવસાય અને વાણિજ્યિક પ્રકૃતિના વ્યવહારો માટે થવો જોઈએ. શંકાસ્પદ અથવા અનિચ્છનીય ગણાતા વ્યવહારોના કિસ્સામાં, બેંક પાસે આવા ખાતાઓમાં એકપક્ષીય રીતે ખાતામાં વ્યવહારો સ્થગિત કરવા અને/અથવા ખાતા બંધ કરવાનો અબાધિત અધિકાર છે.
- બેંકનું ખાતું ખોલાવતા સમયે સૂચવ્યા અનુસાર ગ્રાહકે ખાતામાં સમયાંતરે જરૂરી ન્યૂનતમ સરેરાશ ત્રિમાસિક બેલેન્સ જાળવવાનું રહેશે. શાખાઓના નોટિસ બોર્ડ તેમજ વેબસાઈટ પર બેંક/સર્વિસ ચાર્જ અથવા ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાત સંદર્ભે કરાયેલા ફેરફાર દર્શાવવામાં આવે છે. પર્યાપ્ત બેલેન્સ ન જાળવવાથી બેંકને સરેરાશ બેલેન્સ ન જાળવી રાખવા માટેના ચાર્જસ લાદવાનો અધિકાર આપોઆપ મળી જાય છે. આવી ઘટનામાં, બેંક પાસે બેંકના ઉક્ત ખાતામાં જમા થતી રકમ અથવા જો કોઈ ઉપલબ્ધ જમા રકમ હોય તો તે સહિતની ઉપલબ્ધ રકમમાંથી સરભર કરવાનો પ્રથમ અધિકાર રહેલો છે.
- ઉપરોક્ત સૂચનો ઉપરાંત, જો બેંકનો અભિપ્રાય હોય કે ગ્રાહક સરેરાશ ત્રિમાસિક બેલેન્સ જાળવી શકતો નથી અને/અથવા જો ખાતું શૂન્ય બેલેન્સ ખાતું રહે છે અને/અથવા ખાતાનું એકંદર સંચાલન સંતોષકારક નથી, તો બેંકને ૧૫ દિવસની નોટિસ આપીને ખાતું બંધ કરવાનો અધિકાર રહેશે. જો ૧૫ દિવસની અંદર ઉપરોક્ત ખાતામાં ભંડોળ પૂરું પાડવામાં આવે તો બેંક ખાતું બંધ કરવાના ઉપરોક્ત અધિકારનો ઉપયોગ કરી શકશે નહીં. નહીંતર બેંક ગ્રાહકને ૧૫ દિવસની નોટિસ આપીને ખાતું બંધ કરશે.
- જો ખાતામાં ૨ વર્ષ સુધી કોઈ વ્યવહાર ન થાય તો ખાતું આપમેળે નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત થઈ જાય છે અને ત્યારબાદ સામાન્ય રીતે વધુ ઉધાર વ્યવહારોની મંજૂરી હોતી નથી. ગ્રાહકે નવા કેવાયસી દસ્તાવેજ આપીને ખાતું સક્રિય કરવા અરજી કરવાની રહેશે.
- નાણાકીય અને બિન-નાણાકીય એમ બંને પ્રકારની કોઈપણ વિશેષ સૂચનાઓ, જેમ કે સ્ટેટિંગ ઇન્સ્ટ્રક્શન્સ, સ્ટોપ પેમેન્ટ, નવી ચેક બુક જારી કરવી, ડિમાન્ડ ડ્રાફ્ટ્સ, પે ઓર્ડર, ડુબ્લિકેટ કાર્ડ / પિન જારી કરવા, વગેરે અંગેની જાણ લેખિતમાં કરવી આવશ્યક છે. અન્યથા, આવી સૂચનાઓનું પાલન કરવું બેંક પર બંધનકર્તા રહેશે નહીં. જેમાં લાગુ પડતા ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલવામાં આવશે.
- એનીવ્હર બ્રાન્ચ બેંકિંગ (એબીબી) સુવિધા અને એટ પાર ચેક સુવિધાનો લાભ ઉક્ત સુવિધાઓ માટે નિર્ધારિત મર્યાદાઓ અને સર્વિસ ચાર્જસ પર આધારિત છે.
- બેંકને સરનામામાં કોઈપણ ફેરફારની જાણ તુર્ત જ સરનામાના પુરાવા સાથે લેખિતમાં કરવાની રહેશે.
- જો ખાતું ખોલવા માટે જમા કરવામાં આવેલા કેવાયસી દસ્તાવેજો સંતોષકારક ન જણાય તો બેંક પાસે ખાતું બંધ કરવાનો અધિકાર અનામત રહે છે.
- ચેક પર લખેલી માહિતી સુવાચ્ય હોવી જોઈએ. સીટીએસ ક્લિયરિંગ હેઠળ કોઈ ફેરફાર કે ઓવરરાઈટિંગ ચલાવવામાં આવતું નથી. તારીખના ફિલ્ડમાં તમારી સંપૂર્ણ સહી સાથે સુધારેલી તારીખને પ્રમાણિત કરીને ફેરફાર કરી શકાય છે.
- ભારતમાં વસતો કોઈપણ વ્યક્તિ કે જે ઇલેક્ટ્રોનિક/ઇન્ટરનેટ ટ્રેડિંગ પોર્ટલ મારફતે વિદેશી વિનિમય વેપાર માટે ભારતની બહાર પ્રત્યક્ષ/પરોક્ષ રીતે કોઈપણ સ્વરૂપમાં ચુકવણી મેળવે છે અને પ્રાપ્તિ/મોકલવાની ક્રિયા કરે, તો તે વ્યક્તિ ખુદને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફએમએ), ૧૯૯૮ના ઉલ્લંઘન બદલ જવાબદાર ઠરશે, ઉપરાંત તમારા ગ્રાહકને જાણી (કેવાયસી) ધોરણો/મની લોન્ડરિંગ વિરોધી (એએમએલ) ધોરણો સંબંધિત નિયમોના ઉલ્લંઘન માટે તે વ્યક્તિ જવાબદાર રહેશે.
- બેંક પાસે ઉપરોક્ત નિયમોમાં કોઈપણ સમયે નોટિસ વિના કોઈપણ ફેરફાર, સુધારા, રદ કરવા અંગેની અધિકાર રહેલો છે. ખાતું ખોલાવનાર કોઈપણ વ્યક્તિને ખાતાના સંચાલન માટેનાં નિયમો બંધનકર્તા રહેશે.
- હું/અમે સમજીએ છીએ કે, આરબીઆઈની માગરેખા અનુસાર, બેંકને મારા/અમારા ખાતામાં થયેલા વ્યવહારો પર સતત દેખરેખ દ્વારા યોગ્ય તપાસ કરવાનો અધિકાર છે. ખાતું ખોલાવતી વખતે આપવામાં આવેલી મારી/અમારી પ્રોફાઇલ સાથે આ વ્યવહારો બંધબેસતાં છે કે નહીં તેની ખાતરી માટે આવી કાર્યવાહી અનુસરવામાં આવે છે. જો મારી/અમારી પ્રોફાઇલની વિગતોમાં કોઈ ફેરફાર થાય, તો મારી/અમારી જવાબદારી બને છે કે તે અંગેની જાણકારી તાત્કાલિક બેંકને કરવામાં આવે.
- માહિતીની આપલે/ ઘોષણા: a. બેંકમાં કોઈ ખાતું ખોલાવી અને તેની જાળવણી કરી ગ્રાહક બેંકને ગ્રાહકનું સંબંધિત ખાતું/વ્યક્તિગત માહિતી બેંક પાસે ઉપલબ્ધ હોય તેવી કોઈપણ સંસ્થા સાથે શેર/જાહેર કરવાનો અધિકાર આપે છે. જેમને આવી માહિતી મેળવવાનો અધિકાર છે, તેમાં નીચેની યાદીમાં સૂચવેલ સંસ્થાઓનો સમાવેશ થઈ શકે છે પરંતુ તે મર્યાદિત નથી:
 - ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)
 - તેના અધિકૃત પ્રતિનિધિ/ સંસ્થાના માધ્યમથી ભારત સરકાર
 - અદાલતો/ તપાસકર્તા એજન્સી
 - સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)
 - સ્ટોક એક્સચેન્જના અધિકૃત પ્રતિનિધિઓ
 - ઓડિટર્સ, વ્યાવસાયિક, સલાહકારો
 - જેમની સાથે બેંક દ્વારા 'સેવાઓ/ પ્રોડક્ટ્સ' બાબતનો કાનૂની કરાર કરવામાં આવ્યો હોય અને જેમને માહિતી મેળવવાની જરૂર રહેતી હોય તેવા થર્ડ પાર્ટી સર્વિસ પ્રુવાઇડર્સ.
 - આવા પ્રકારની માહિતી મેળવવા માટે જે હકદાર છે તેવી અન્ય કાનૂની સંસ્થા/ અધિકૃત વ્યક્તિઓ

ix. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો સહિત પરંતુ સિબિલ સુધી મર્યાદિત નહીં

x. ફાયનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ-આઈએનડી)

xi. આયકર

વિભાગકોઈપણ સમયે આવી ગમે તે નિયમનકારી સંસ્થાઓ, કાયદા અમલકર્તા સંસ્થાઓ, મહેસૂલ સત્તાધિશો અને અન્ય કોઈપણ સત્તાધિશોને તેની જરૂર પડી શકે છે.
b. બેંક પાસે ગ્રાહક કે તેના ખાતા/નાણાકીય સ્થિતિ વિશેની કોઈપણ અન્ય માહિતી બેંકને યોગ્ય વાગે તે રીતે કોઈપણ સ્રોત દ્વારા મેળવવાનો અધિકાર અનામત રહે છે.
c. ટીજેએસબી સહકારી બેંક લિ. તેના ગ્રાહકોના સંપર્કની માહિતીનો ઉપયોગ સેવા અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ માટે કરે છે. ટીજેએસબી સહકારી બેંક લિ. આ સંદર્ભે ખાતું ખોલાવતી વખતે ગ્રાહક પાસેથી અભિવ્યક્તિ દ્વારા સંમતિ મેળવે છે.

૧૪. બાંધી મુદતની થાપણ (ફિક્સ્ડ ડિપોઝિટ)

- જો એક મુદતની થાપણ પાકી જાય અને તેની રકમ ચૂકવાય નહીં, તો ટીજેએસબી સહકારી બેંક પાસે દાવો કરાયા વિના પડી રહેલી રકમ પર બચત ખાતામાં લાગુ પડતો હોય તે વ્યાજનો દર લાગુ પડે અથવા તો પાકી ગયેલી મુદતની થાપણના કરારિત વ્યાજનો દર, બંનેમાંથી જે ઓછું હોય તે લાગુ પડે.
- ડીઆઈસીજીસીમાં થાપણનો વીમો રૂા. ૫,૦૦,૦૦૦/-ની મહત્તમ રકમ સુધી હોય છે.
- અરજદાર/રો, તેમના પહેલા/બાદના /ફર્સ્ટ નેમ/સેકન્ડ નેમ વગેરે અથવા તેમનામાંથી કોઈ અથવા હયાત વ્યક્તિ, તેમનામાંથી કોઈ અથવા હયાત વ્યક્તિ અથવા જીવિત વ્યક્તિ તરફથી લેખિત અરજી પ્રાપ્ત થયા બાદ, સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને બેંક દ્વારા નિર્ધારિત નિયમો અને શરતોને આધીન રહીને, (a) તેમના સંયુક્ત નામે જારી કરવામાં આવનાર ટર્મ ડિપોઝિટ રસીદના જામીન સામે ધિરાણ/એડવાન્સ મંજૂર કરી શકે છે અથવા (b) તેમનામાંથી પહેલા/બાદના/ ફર્સ્ટ નેમ/તેમનામાંથી બીજા અથવા હયાત વ્યક્તિ વગેરે/ તેમનામાંથી કોઈ અથવા હયાત વ્યક્તિ અથવા જીવિત વ્યક્તિને થાપણની રકમની બાંધી મુદત અગાઉની (પાક્યા પહેલાં) ચૂકવણી કરી શકે છે.

ઓટો રિન્યુઅલ ટર્મ ડિપોઝિટના નિયમો અને શરતો

- બાંધી મુદતની થાપણ (ટર્મ ડિપોઝિટ)ની રસીદ તબદીલ થઈ શકે નહીં.
- થાપણ/પાકવાની રકમ પરનું વ્યાજ ટીડીએસ અને તેના પરના વ્યાજ પર આધિન છે.
- જો થાપણદાર ટીડીએસમાંથી મુક્તિ ઇચ્છતા હોય, તો તેમણે નવી થાપણ અને દરેક થાપણના રિન્યુઅલ સમયે ફોર્મ ૧૫ જી/એચ ડુપ્લિકેટમાં રજૂ કરવાવા રહેશે. ફોર્મ ૧૫જી/એચમાં વિવંધ અથવા સભમિત ન થવાને કારણે થતા કોઈપણ પરિણામો અથવા નુકસાન માટે બેંક જવાબદાર રહેશે નહીં. થાપણદારે ગ્રાહકની કરપાત્ર આવક શૂન્ય હોય તેને લાગુ પડતા ફોર્મ ૧૫ જી/એચની સાથે પીએએનનો પુરાવો પણ રજૂ કરવો જરૂરી છે.
- થાપણની પરિપક્વતા સમયે મળતી રકમ અંગેની સૂચના બેંક ટર્મ ડિપોઝિટ નોંધાવતા સમયે આપશે. પરિપક્વતા અંગેની સૂચનાઓમાં જો કોઈ ફેરફાર હોય તો, બેંકને પરિપક્વતા તારીખના એક અઠવાડિયા પહેલાં જાણ કરવામાં આવશે. કૃપા કરીને બેંક સાથે ભવિષ્યના પત્રવ્યવહાર માટે એકાઉન્ટ નંબર લખવો.
- જેમાં પરિપક્વતા પહેલાં ટર્મ ડિપોઝિટનું એન્ટેશમેન્ટ સામેલ છે એવા કિસ્સામાં પરિપક્વતા પહેલાં કોઈપણ સૂચનાઓ ઉપરાંત તેની મૂળ રસીદની સાથે તમામ થાપણદારોની સહી જરૂરી છે.
- જો પાકતી મુદતના નિકાલ અંગે ખાતામાં જમા/સ્વતઃ નવીકરણની સૂચના હોય, તો મૂળ ટર્મ ડિપોઝિટ રસીદ રદ થાય છે.
- બેંક તેના વિવેકબુદ્ધિથી શિક્ષાત્મક વ્યાજની ચૂકવણીને આધિન, મુદતની થાપણના મુદત પહેલાં ઉપાડની મંજૂરી આપી શકે છે.
- મુદત પાકી ગયાથી ૧૦ વર્ષથી વધુ સમય માટે જો ટર્મ ડિપોઝિટ પર કોઈ દાવો કરવામાં ન આવ્યો હોય, તો આરબીઆઈની વર્તમાન માગરિખા અનુસાર તેને આરબીઆઈના ડીઈએએફ (ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ) સ્કીમમાં તબદીલ કરવામાં આવશે.
- ચાલુ ખાતામાં નોમિનીમાં ફેરફાર હોય તેમ છતાં ટ્રાન્સફર થતી રકમના સંદર્ભમાં કોઈપણ વિવાદ માટે બેંક જવાબદાર રહેશે નહીં. એટલે કે, જો ટર્મ ડિપોઝિટ ખાતા માટે નોમિની અને જ્યાં મેન્ડેટ આપવામાં આવ્યું છે તે ચાલુ ખાતા માટે નોમિની અલગ હોય, તો બેંક તેના માટે જવાબદાર રહેશે નહીં. બાંધી મુદતની થાપણ મુકતી વખતે ગ્રાહક દ્વારા આપવામાં આવેલ મેન્ડેટને અંતિમ માનવામાં આવશે.
- થાપણદારોને પૂર્વ-સૂચના આપ્યા વિના સમયાંતરે નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર બેંક પાસે અબાધિત રહે છે અને આવાં નિયમો લાગુ કરાયા તારીખથી અમલમાં આવશે.

પ્રથમ અરજદારની વિગતો

PASSPORT SIZE PHOTO

THUMB / SIGNATURE

બ્રાન્ચ _____ બ્રાન્ચ કોડ

કસ્ટમર આઈડી

સીકેવાયસી નં.

અરજદારની વિગતો

અરજદારનું નામ ઉદબોધન ફર્સ્ટ નેમ મિડલ નેમ થર્ડ નેમ લાસ્ટ નેમ

પિતાનું નામ*:

પતિ/પત્નીનું નામ*:

(જો 'પરિણિત' દર્શાવ્યું હોય તો ફરજિયાત છે)

માતા અપરિણિત હતા ત્યાંનું નામ*:

જન્મ તારીખ*: જાતિ*: પુરુષ સ્ત્રી નપુંસક

વૈવાહિક સ્થિતિ*: પરિણિત અપરિણિત અન્ય કૃપા કરી વિગત આપો

રાષ્ટ્રીયતા*: ભારતીય અન્ય (આઈએસઓ 3166 કંટ્રી કોડ):

રહેઠાણ/કાયમી વસવાટની સ્થિતિ*: નિવાસી બિન-નિવાસી

જન્મ ભૂમિ (દેશ)*: _____ આઈએસઓ 3166 અનુસાર કંટ્રી કોડ ઓફ બર્થ*:

સિનિયર સિટીઝન: હા ના

ટીજેએસબી સ્ટાફ કેટેગરી: કાયમી નિવૃત્ત લાગુ પડતું નથી

શૈક્ષણિક લાયકાત: અશિક્ષિત બિન-સ્નાતક સ્નાતક અનુસ્નાતક અન્ય _____ કૃપા કરી વિગત આપો

વ્યવસાય: નોકરી (ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર સરકારી ક્ષેત્ર) નિવૃત્ત ગૃહિણી વિદ્યાર્થી અન્ય કૃપા કરી વિગત આપો

વ્યાવસાયિક સેલ્ફ એમ્પ્લોઈડ ધંધો * કૃપા કરીને વ્યાવસાયિક/ સેલ્ફ એમ્પ્લોઈડ/ધંધાની લીટીમાં વિગતો ભરી _____

ધર્મ: હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી બૌદ્ધ જૈન યહૂદી પારસી શીખ અન્ય

જાતિ: સામાન્ય અન્ય પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિચરતી જનજાતિ પછાત જાહેર નથી

અન્ય કૃપા કરીને સ્પષ્ટ કરો _____

વિશેષ જરૂરિયાત: દૃષ્ટિથી અંધ દિવ્યાંગ

આવકની વિગતો: ૦ થી ૨.૫ લાખ ૨.૫ લાખથી વધુ અને ૫ લાખ સુધી ૫ લાખથી વધુ અને ૧૦ લાખ સુધી ૧૦ લાખથી વધુ અને ૧૫ લાખ સુધી

૧૫ લાખથી વધુ અને ૨૦ લાખ સુધી ૨૦ લાખથી વધુ

વાર્ષિક આવક*: રૂા. _____ રકમ શબ્દોમાં

આવકનો સ્ત્રોત*: _____

પીએએનની વિગતો

પીએએન નં.

ફોર્મ નં

રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની યાદી*

રજૂ કરાવેલા દસ્તાવેજોની યાદી	દસ્તાવેજ સંદર્ભ નં.	લાગુ પડતું હોય ત્યાં ટીક કરો		જારી કર્યા તારીખ (લાગુ પડતું હોય ત્યાં) તારીખ-મહિનો-વર્ષ	સમાપ્તિની તારીખ (લાગુ પડતું હોય ત્યાં) તારીખ-મહિનો-વર્ષ
		ઓળખનો પુરાવો	સરનામાનો પુરાવો		
પીએએન/ ફોર્મ નં					
આધાર					
વીઆઈડી નં.					
પાસપોર્ટ					
ડ્રાઈવિંગ લાઇસન્સ					
મતદાર ઓળખ કાર્ડ					
એનઆરઈજીએ જોબ કાર્ડ					
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર દ્વારા જારી કરવામાં આવેલો પત્ર					
અન્ય માન્ય ઓવીડી					
૧.					
૨.					
૩.					

કાયમી સરનામું*

એડ્રેસ લાઈન ૧	
એડ્રેસ લાઈન ૨	
એડ્રેસ લાઈન ૩	
ગામ	તાલુકો જિલ્લો શહેર
રાજ્ય	પીન કોડ પોસ્ટ ઓફિસ

પત્રવ્યવહાર માટે / હાલનું સરનામું* ■ કાયમી સરનામા મુજબ

એડ્રેસ લાઈન ૧	
એડ્રેસ લાઈન ૨	
એડ્રેસ લાઈન ૩	
ગામ	તાલુકો જિલ્લો શહેર
રાજ્ય	પીન કોડ પોસ્ટ ઓફિસ

સંપર્કની વિગતો

(પ્રથમ ખાતાધારકનું સરનામું, ઇમેઇલ આઈડી અને વૈકલ્પિક સંપર્ક વિગતો દરેક સંપર્ક વ્યવહાર માટે ચિહ્નિત કરવામાં આવશે)

પ્રાથમિક મોબાઇલ નંબર* વૈકલ્પિક મોબાઇલ/ટેલિફોન નં. ઇમેઇલ આઈડી:

(નેટ/મોબાઇલ બેન્કિંગ સુવિધા મેળવવા માટે ફરજિયાત)

નોકરીદાતા/વ્યવસાયની વિગતો

સંગઠનનું નામ: ડીડી: ઓફિસનો ટેલિફોન નં:

જોડાયા/સ્થાપનાની તારીખ D D M M Y Y Y Y

રોજગારી/વ્યવસાયનું સરનામું:

એડ્રેસ લાઈન ૧	
એડ્રેસ લાઈન ૨	
એડ્રેસ લાઈન ૩	
ગામ	તાલુકો જિલ્લો શહેર
રાજ્ય	પીન કોડ પોસ્ટ ઓફિસ

પીઈપીની વિગતો

શું તમે પીઈપી (પોલિટિકલ એક્સપોઝ્ડ પર્સન)* છો? ☐ હા ☐ ના (ભારતીય / વિદેશી પીઈપી)

શું તમે પીઈપીના પરિવારના સદસ્ય/નિટકવર્તી સાથી છો? ☐ હા ☐ ના

જો હા, તો કૃપા કરીને નીચે વિગતો આપો -

અનુ. નં.	પીઈપીનું નામ	પીઈપી સાથે સંબંધ

એફએસીટીએ / સીઆરએસ સ્વ-પ્રમાણપત્ર

ભારતની બહારના ન્યાયક્ષેત્ર(ત્રી)માં કરવેરા હેતુ માટેનું રહેઠાણ

રહેઠાણના ન્યાયક્ષેત્ર*નો આઈએસઓ ૩૧૬૬ કંટ્રી કોડ ☐

ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર અથવા સમકક્ષ (જો ન્યાયક્ષેત્ર* દ્વારા જારી કરવામાં આવ્યો હોય)

ટેક્સ રેસિડેન્સીનો દેશ	પીએએન/ટીઆઈએન (ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર) / ફક્શનલ ઇક્વિવેલન્ટ	પીએએન/ટીઆઈએન જારી કરનાર દેશ/ ફક્શનલ ઇક્વિવેલન્ટ ઇસ્યુઈંગ કંટ્રી	સમાપ્તિની તારીખ	પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો#

શું તમે અમેરિકાના નાગરિક છો? ☐ હા ☐ ના શું તમે ગ્રીન કાર્ડ હોલ્ડર છો? ☐ હા ☐ ના શું તમે અમેરિકાના રહેવાસી છો? ☐ હા ☐ ના

a. ઉપરોક્ત પ્રતિક્રિયાઓમાંથી કોઈ એક કિસ્સામાં તમે જો અમેરિકાના નાગરિક છો કે એક વ્યક્તિ જે કરવેરાના હેતુસર ભારતની બહાર રહેતો હોય અને તમે ટેક્સપેયર આઈડેન્ટિફિકેશન નંબર/કાર્યકારી સમકક્ષ ન ધરાવતા હોય, તો કૃપા કરીને સ્વ-પ્રમાણપત્ર પૂર્ણ કરો અને તેમાં સહી કરો.

b. તમે અમેરિકાના વ્યક્તિ તરીકેના સ્ટેટસમાં 'ના' ઘોષિત કરી રહ્યા છો પરંતુ તમારી જન્મભૂમિનો દેશ અમેરિકા છે એવા કિસ્સામાં, કૃપા કરીને નાગરિકતા ત્યાગના પુરાવા આપતા દસ્તાવેજો પ્રદાન કરો. જો ઉપલબ્ધ ન હોય તો ત્યાગ પ્રમાણપત્ર ન હોવાના કારણો પ્રદાન કરો. કૃપા કરીને સ્વ-પ્રમાણપત્ર ભરો.

(i) ખોટી જુવાનીના દંડ હેઠળ, હું/અમે પ્રમાણિત કરીએ છીએ કે: ૧. અરજદાર (i) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ("યુ.એસ.") અથવા તેના કોઈ રાજ્ય અથવા રાજકીય પેટાવિભાગ કે તેમાં, ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અથવા યુ.એસ.ના કોઈપણ અન્ય રાજ્યો સહિત, કાયદા હેઠળ યુએસ વ્યક્તિ તરીકે કરપાત્ર અરજદાર છે, (ii) એવી મિલકત જેની આવક તેના સ્રોતને ધ્યાનમાં લીધા વિના યુ.એસ. ફેડરલ આવકવેરાને આધીન છે. (આ કલમ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જો ખાતાધારકની ઓળખ અમેરિકાના વ્યક્તિ તરીકેની થાય) ૨. અરજદાર ભારત બહારના દેશના કાયદા હેઠળ નિવાસી કરદાતા તરીકે કરપાત્ર અરજદાર છે. (આ કલમ ફક્ત ત્યારે જ લાગુ પડે, જો ખાતાધારક ભારતની બહાર કર નિવાસી હોય)(ii) હું/અમે સમજીએ છીએ કે બેંક એફએટીસીએ/સીઆરએસના પાલનમાં ઉપરોક્ત નામ આપવામાં આવેલા અરજદારનું સ્ટેટસ નિર્ધારિત કરવાના હેતુસર આ માહિતી પર આધાર રાખી રહી છે. બેંક સીઆરએસ અથવા એફએટીસીએ અથવા અરજદાર પર તેની અસર અંગે કોઈ કર સલાહ આપી શકતી નથી. હું/અમે કોઈપણ કર પ્રશ્નો માટે વ્યાવસાયિક કર સલાહકાર પાસેથી સલાહ મેળવીશું.

(iii) જો આ ફોર્મ પરની કોઈપણ માહિતી અથવા પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો હું/અમે ૩૦ દિવસની અંદર નવું ફોર્મ રજૂ કરવા સંમત છીએ.

(iv) હું/અમે સંમત છીએ કે સ્થાનિક નિયમનકારો/કર સત્તાધિશો દ્વારા જરૂરી હોય તેમ, બેંકને સીબીડીટીને રિપોર્ટ કરવા યોગ્ય વિગતોની જાણ કરવાની અથવા મારું ખાતું બંધ અથવા રદબાતલ કરવાની પણ જરૂર પડી શકે છે.

v) હું/અમે પ્રમાણિત કરીએ છીએ કે હું/અમે આ ફોર્મ પર માહિતી પૂરી પાડીએ છીએ અને મારા/અમારા શ્રેષ્ઠ જ્ઞાન અને માન્યતા મુજબ પ્રમાણપત્ર સાચું, યોગ્ય અને સંપૂર્ણ છે જેમાં અરજદારનો કરદાતા ઓળખ નંબર પણ સામેલ છે.

નામ: _____

સહી: _____

તારીખ:

D	D	-	M	M	-	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---	---	---

ટીઆઈએન/ કાર્યકારી સમકક્ષ અને કર નિવાસ માટે પૂરા પાડવાના દસ્તાવેજી પુરાવાની નકલ #સ્વપ્રમાણિત હોવી ફરજિયાત છે.ટીઆઈએનના #કાર્યકારી સમકક્ષમાં નીચે દર્શાવેલ બાબતોનો સમાવેશ થાય છે: સોશિયલ સિક્યુરિટી/ઇન્સ્યુરન્સ નંબર, સિટીઝન/ પર્સનલ આઈડેન્ટિટી/સર્વિસીસ કોડ / નેશનલ આઈડેન્ટિટી નંબર, રેસિડેન્ટ/પોપ્યુલેશન રજિસ્ટ્રેશન નંબર, એલિયન કાર્ડ નંબર, વગેરે.

•જો સંસ્થા અને અધિકૃત સહીકર્તાઓ બિન-નિવાસી હોય તો અલગ ઘોષણાપત્ર રેકૉર્ડ પર મેળવવું જોઈએ (ટીજેએસબી ઓનલાઈન - ફોર્મ સેન્ટર પર અપલોડ કરવામાં આવ્યું છે)

એફએસીટીએ / સીઆરએસ સ્વ-પ્રમાણપત્ર

ત્યારે જ ભરવું જો- (a) પાર્ટ ૧ માં દેશનું નામ ભારત સિવાયનું હોય અને ટીઆઈએન અથવા કાર્યકારી સમકક્ષ ઉપલબ્ધ ન હોય, અથવા (b) પાર્ટ ૧માં યુએસ પર્સનને યસ તરીકે દર્શાવવામાં આવ્યો હોય, અને ટીઆઈએન ઉપલબ્ધ ન હોય.

હું સમર્થન આપું છું કે હું અમેરિકાનો નાગરિક નથી કે વેરાના હેતુસર ભારત સિવાય અન્ય કોઈ દેશનો રહેવાસી નથી, તેમ છતાં એક કે તેથી વધુ માપદંડો મારા સંબંધો ભારતની બહારના દેશ સાથે હોવાનું સૂચવે છે. તેથી, હું મારા નાગરિકત્વ અને ભારતના રહેવાસી હોવાના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજો પૂરા પાડી રહ્યો છું.

નામ: _____

સહી: _____

તારીખ:

D	D	-	M	M	-	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---	---	---

સ્થળ: _____

દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે (ફૂપા કરીને રજૂ કરાયેલાં દસ્તાવેજો ટીક કરો)

☐ પાસપોર્ટ ☐ મતદાર આઈડી કાર્ડ ☐ ડ્રાઈવિંગ લાઈસન્સ ☐ આધાર કાર્ડ ☐ એનઆરઈજીએ જોબ કાર્ડ

એકરારનામું

હું/અમે અત્રે જાહેર કરીએ છીએક કે ઉપર તૈયાર કરવામાં આવેલ માહિતી અને એકરારનામું/નામાં મારી/અમારી જાણકારી પ્રમાણે યોગ્ય અને સાચા છે.

સહી: _____

નામ: _____

તારીખ:

D	D	-	M	M	-	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---	---	---

સ્થળ: _____

ફક્ત શાખાના ઉપયોગ માટે જ

દસ્તાવેજો પ્રાપ્ત કરવામાં આવ્યાં ☐ સ્વ-પ્રમાણિત ☐ ખરી નકલો ☐ નોટરી

☐ કર્મચારી ☐ બીસી દ્વારા વ્યક્તિગત રીતે ચકાસણી કરવામાં આવી

ઓળખની ચકાસણી ☐ કરવામાં આવી તારીખ

D	D	-	M	M	-	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---	---	---

કોડ આઈએન

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

કર્મચારી/બીસીનો કોડ

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

કર્મચારીનો હોદ્દો

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

કર્મચારી/બીસીની શાખા

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

[કર્મચારી/બીસીની સહી]

જોખમની કેટેગરી: ☐ ઊંચી ☐ મધ્યમ ☐ નીચી

☐ સીડીડી મેળવ્યું ☐ ઇડીડી મેળવ્યું (લાગુ પડે છે તે મુજબ)

સંસ્થાની વિગતો
નામ ટીજેએસબી સહકારી બેંક લિ.
કોડ આઈએન IN0860

બેંકનો
સિક્કો

મેનેજરની સહી

(This Page Intentionally Left Blank)

